

Long-Term Care Home Update

Community Newsletter



માર્ચ 2022

નોંધપાત્ર કામગીરી પ્રાપ્ત કરવામાં આવી

માર્ચ 2નાં દિવસે, Lakeridge Gardensએ નોંધપાત્ર કામગીરી પ્રાપ્ત કરી. મોટી સિદ્ધિ કહી શકાય તેવું તેનું સીમાચિહ્નરૂપ બાંધકામ છે જે તમામ મુખ્ય બાંધકામ પૂર્ણ થયું હોવાનું સૂચવે છે અને સાથોસાથ એ પણ કે હવે સંચાલન કરવા માટે ઘરની ચાવીઓ Lakeridge Healthને સુપરત કરી દેવામાં આવેલી છે. એક બાજુથી જ્યારે ઔપચારિકપણે આ મહિને ઘરનું ઉદ્ઘાટન કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે ત્યારે નિવાસીઓ મકાનનો કબજો મેળવી શકે એ માટે Lakeridge Health તેનું છેવટનું આયોજન અને તૈયારીઓ કરવાનું ચાલુ રાખશે.


આ સીમાચિહ્નરૂપને તેમજ ઘરની અદ્ભુત પ્રગતિને ચિહ્નિત કરવા માટે PCL Constructionએ એક લઘુચિત્ર દસ્તાવેજ તૈયાર કર્યું છે. વીડિયોમાં ઘર બનાવવા માટે શરૂ થી અંત સુધી કેવી રીતે આયોજન, નવીનીકરણો અને ભાગીદારીઓ કરવામાં આવે છે તેને દર્શાવવામાં આવ્યું છે.

વિડીયો જોવા અને અન્યોને મોકલવા માટે નીચેની ઈમેલ પર ક્લિક કરો!



Lakeridge Gardensને આંકડાકીય દૃષ્ટિએ જોતાં:

- આશ્ચર્યજનક રીતે નોંધપાત્ર બાબત એ હતી કે મુખ્ય બાંધકામ **13 મહિનામાં** પૂર્ણ કરવામાં આવ્યું હતું. ભલે વર્ષો નહીં, તો પણ લાક્ષણિક દૃષ્ટિએ જોતાં એક લાંબાગાળાની સંભાળનું ઘર ચાલુવામાં અનેક મહિનાઓ લાગી શકે છે.
- Lakeridge Gardensનાં આખા ઘરમાં **500થી વધુ બારીઓ** અને **1,000 દરવાજાઓ** બેસાડેલા જોવા મળે છે.
- Lakeridge Gardensમાં એક જ દિવસમાં સાઈટ પર **600થી વધુ** કુશળ કામદારો કામ કરતા જોવા મળ્યા હતા.



નિવાસીઓ ક્યારે નવા મકાનનો કબજો મેળવશે?

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નિવાસીઓ 29મી માર્ચ, 2022ના મંગળવારના દિવસે નવા મકાનનો કબજો મેળવવાનું શરૂ કરશે.

શું હું Lakeridge Gardensની મુલાકાત લઈ શકું છું?

આ સમયે ચાલી રહેલ COVID-19 પ્રોટોકોલને કારણે અમે વ્યક્તિગતપણે એરિયામાં મુલાકાતે આવવા માટે વ્યવસ્થા કરી શકવા માટે અસમર્થ છીએ. તેમ છતાં, બહુ જલદીથી એક વીડિયો પ્રવાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી સમુદાયનાં પરિવારો અને સભ્યો વાસ્તવિક લાગે તેવા આભાસીપણે નવા ઘરમાં સફર કરી શકશે.

મુલાકાતીઓ ક્યાં પાર્કિંગ કરી શકે છે?

Lakeridge Gardensની સામેનાં ભાગે લાંબાગાળાની સંભાળ લેનારા મુલાકાતીઓ માટે મર્યાદિત સંખ્યામાં પાર્કિંગ સ્પોટ્સ આવેલ છે. ઘરને અડીને અમે પાર્કિંગ ગેરેજનું પણ નિર્માણ કરી રહ્યાં છીએ જે બંને Lakeridge Gardens અને Lakeridge Health's Ajax Pickering Hospital માટે સહાયભૂત નીવડશે.

Lakeridge Gardensમાં કેટલી ટુકડીનાં સભ્યો કામ કરશે?

Lakeridge Gardens સ્થિત 500થી વધુ સંભાળ લેનારા અને વહીવટી કર્મચારી-વર્ગ કામ કરે છે, જેમાં તમામે તમામ ઉચ્ચ તાલીમ પામેલ છે ઉપરાંત લાંબાગાળાની સંભાળ લેવામાં અનેક વર્ષોનો અનુભવ ધરાવે છે.

મર્યાદિત પાર્કિંગની જગ્યામાં ટુકડીનાં સભ્યો ક્યાં પાર્ક કરશે?

પાછલી સિંગ્રામાં, Lakeridge Gardensમાં પાર્કિંગમાં મદદરૂપ થવા માટે લાંબા સમયથી સ્થાનિક માલિકી ધરાવતા એક પારિવારિક વ્યવસાયે Barr Road અને Monarch Avenue સ્થિત જમીનને ઉદારતાપૂર્વક દાનમાં આપી હતી. જ્યાં સુધી પાર્કિંગ ગેરેજ પૂર્ણ ન થાય, ત્યાં સુધી અમે આ સ્થળે પ્રવેશમાર્ગ ચાલુ રાખીશું, તેમજ કર્મચારી-વર્ગ ઘર અને આ પાર્કિંગ લોટથી આવનજાવન ચાલુ રાખશે.

નિવાસીઓ માટે ઘર કેવી રીતે શોધીને આપવામાં આવે છે?

Durham Regionમાં લાંબાગાળાની સંભાળ માટે ઘર શોધીને આપવાનાં કામને [Home and Community Care Support Services Central East](#) દ્વારા સંચાલિત અને સંકલિત કરવામાં આવે છે. શોધીને ઘર આપવાની પ્રક્રિયામાં બહુલ ભાગનાં મૂલ્યાંકનને આવરી લેવામાં આવે છે જેમાં એ બાબતેની ખાતરી રાખવા કે તબીબી ઈતિહાસનાં સચોટ રેકોર્ડ જાળવવામાં આવ્યો હોય, તેમજ લાંબાગાળાની સંભાળનાં ઘર માટેની પાત્રતા નક્કી કરવામાં મદદ કરવા માટે એક Care Coordinator દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે.

ઔપચારિક મુલાકાત લેવા માટેનાં ક્યા-ક્યા નિયમો છે?

Lakeridge Gardens આવવા માટેની જરૂરિયાત એ છે કે COVID-19ની સામે રસીકરણ કરાવ્યું હોવાની સાબિતી બતાવી પડે છે. મુલાકાતીઓએ ઘરમાં દાખલ થતાં પહેલાં ઝડપી એન્ટિજેન પરીક્ષણ પણ કરાવવાનું રહેશે. તમામ કર્મચારી-વર્ગ, કેરગિવર્સ અને નિવાસીઓ જરૂર મુજબ જાહેર સ્વાસ્થ્યનાં પગલાંની પ્રણાલીનું પાલન કરવું ચાલુ રાખશે, જેમ કે, દાખલ થતી વખતે તપાસ અને પરીક્ષણ, મારસ્ક પહેરવું, શારીરિક અંતર જાળવવું, હાથ સ્વચ્છ રાખવા તેમજ જ્યારે બીમાર હો ત્યારે ઘરે રહેવું.



6 ફેબ્રુઆરી, 2022 નાં દિવસે 500-સ્પોટ પાર્કિંગ ગેરેજનું કામ ચાલી રહ્યું છે તેનો એરિઅલ ફોટો



Lakeridge Gardens ના આગળનાં પ્રવેશદ્વારનું એક દૃશ્ય

Lakeridge Gardensનો નવો ફોન નંબર અને ઈમેઇલ

હવે જ્યારે ઘર ખુલ્લું મૂકાવવા માટે તૈયાર થઈ ગયું છે, ત્યારે Lakeridge Gardens માટેની સંપર્ક માહિતી બદલાઈ ગઈ છે. જો તમારે ઘર વિશે કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને કોઈ પણ સમયે અમારા આ **905-428-5201 ext. 17110** નવા નંબર પર કોલ કરો અથવા LakeridgeGardens-info@lh.ca પર ઈમેઇલ કરો.